2<sup>nd</sup> June, 2022

BSE Limited
Listing Dept. / Dept. of Corporate Services,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400 001.

Security Code: 539301
Security ID: ARVSMART

Dear Sir/Madam,

National Stock Exchange of India Ltd. Listing Dept., Exchange Plaza, 5<sup>th</sup> Floor, Plot No. C/1, G. Block, Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051.

Symbol: ARVSMART

Sub: Submission of Newspaper Advertisement in respect Postal Ballot Notice and Remote e-Voting.

Ref: Postal Ballot Notice dated 20<sup>th</sup> May, 2022 for approval of re-appointment of Mr. Nirav Kalyanbhai Shah as an Independent Director.

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the copies of the newspaper advertisement published on 2<sup>nd</sup> June, 2022 in the Financial Express (In English - All India edition and in Gujarati - Ahmedabad Edition) in respect of Postal Ballot Notice and Remote e-Voting information for your information and records.

Please take the same on your record.

Yours faithfully,

For Arvind SmartSpaces Limited

Prakash Makwana Company Secretary



# aurionpro 🚱

#### **AURIONPRO SOLUTIONS LIMITED**

CIN: L99999MH1997PLC111637 Registered Office: Synergia IT Park, Plot No-R-270, T.T.C. Industrial Estate, Near Rabale Police Station, Rabale, Navi Mumbai - 400701 **Ph**: +91 22 4040 7070, **Fax**: +91 22 4040 7080

Web: www.aurionpro.com E-mail: investor@aurionpro.com

#### **NOTICE TO SHAREHOLDERS**

[Pursuant to Section 124(6) of the Companies Act, 2013, read with the Companies Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules 2016]

This Notice is hereby given pursuant to the provisions of the Companies Act. 2013. read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules 2016 as amended from time to time ("the Rules").

Section 124(6) of the Companies Act, 2013, read with the rules inter alia, provide for transfer of all shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more to the Investor Education and Protection Fund (IEPF) set up by the Central Government.

The Company has identified such shareholders who have not claimed dividend for more than seven consecutive years and has sent notices to their respective address available with Company. A list of such shareholders, who has not claimed dividends for more than seven consecutive years has also been published on the Company's website, www.aurionpro.com under 'Investors Section'.

The Members are requested to make a request to the Company Registrar and Transfer Agents on or before 10th October 2022 for claiming the unclaimed dividend so that the shares will not be get transferred to the IEPF. The Members may note that, if for whatsoever reason if any member fails to claim the dividend for previous seven consecutive financial years before 10<sup>th</sup> October 2022 the Company will transfer the shares to the IEPF, without any further notice

It may also be noted that upon transfer of shares to IEPF, those shares and all benefits accruing on thereon, if any, can be claimed from the IEPF after following the procedure prescribed under the Rules.

For any clarification on the matter, please contact the Company's Registrar and Transfer Agents: M/s Bigshare Services Pvt Ltd., Office No S6-2, 6<sup>th</sup> floor, Pinnacle Business Park, Next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East), Mumbai - 400 093.

#### Registered Office

Synergia IT Park, Plot No-R-270, T.T.C. Industrial Estate Road, Near Rabale Police Station Rabale, Navi Mumbai - 400 701 **CIN**: L99999MH1997PLC111637 Contact No.: 91 22 4040 7070 Fax No.: 91 22 4040 7080

E-mail: investor@aurionpro.com Website: www.aurionpro.com Date: 1st June, 2022

By Order of the Board For Aurionpro Solutions Limited

> S/d Ninad Kelkar Company Secretary

# MIRAE ASSET

#### **NOTICE CUM ADDENDUM NO. AD/28/2022**

THIS NOTICE CUM ADDENDUM SETS OUT THE CHANGES TO BE MADE IN THE STATEMENT OF ADDITIONAL INFORMATION ("SAI") OF MIRAE ASSET MUTUAL FUND ("MAMF/FUND") **CESSATION OF KEY PERSONNEL** 

NOTICE is hereby given that, Mr. Krishna Kanhaiya ceases to be 'Chief Financial Officer' of Mirae Asset Investment Managers (India) Private Limited (hereinafter referred to as "the AMC") with effect from

Accordingly, the existing details relating to Mr. Krishna Kanhaiya appearing under the heading 'Information on Key Personnel' under subsection D 'Asset Management Company', under section I 'Information abou Sponsor, AMC and Trustee Companies' in the SAI of the Fund hereby stands deleted.

Further, the SAI of MAMF stands amended suitably to reflect the changes as stated above

This notice cum addendum forms an integral part of SAI, as amended from time to time. All other terms and conditions of SAI will remain unchanged.

> For and on behalf of the Board of Directors of MIRAE ASSET INVESTMENT MANAGERS (INDIA) PVT. LTD. (Asset Management Company for Mirae Asset Mutual Fund)

Place : Mumbai Date : June 01, 2022

**AUTHORISED SIGNATORY** MIRAE ASSET MUTUAL FUND (Investment Manager: Mirae Asset Investment Managers (India Private Limited) (CIN: U65990MH2019PTC324625).
Registered & Corporate Office: 606, Windsor, Off CST Road, Kalina, Santacruz (E), Mumbai - 400098

■ 1800 2090 777 (Toll free), 

□ customercare@miraeasset.com 

□ www.miraeassetmf.co.in Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.

#### C CLASSIFIED CENTRES IN MUMBAI Central Advertising Agency, Mahim (W), Phone: 24468656 / 24465555 NAC Bandra (W), Mobile : 9664132358 Premier Advertisers Mumbai Central Mobile: 9819891116 Sarjan Advertisin<sub>s</sub>, Tardeo, Phone : 66626983 lor Spot, culla (E), one : 23748048 / 23714748 Charudatta Adverti Mahim (W), Phone: 24221461 Reckon Bandra (W.), Mobile : 9867445557 CA Communications, Jariman Point, Phone: 40020550 / 51 Jay Publicity, Dadar (E), Phone : 24124640 Space Age Advertising Bandra (E) Phone: 26552207 Mobile: 9869666222/ 9869998877 Sanjeet Communication Fort. Phone: 40024682/ 40792205. Fulrani Advtg. & Mktg Antop Hill Phone: 24159061 Mobile: 9769238274/ 9969408835 S. Arts Advtg. Masjid Phone: 23415111 Pallavi Advtg. Dadar (W), Mobile: 9869109765 Kirti Agencies, Khar (W), Phone : 26047542. Shree Swami Samarth Advertising, Dadar (W), Phone: 24440631 Mobile: 9869131962 Taj Publicity Services, Byculla (W), Phone: 2305 4894. Mobile: 9892011371. Ganesh Advertising, Abdul Rehman Street, Phone : 2342 9163 / 2341 4596. Hindustan Advertis Vile Parle (W), Phone : 26146229 Yugarambha Aoven... Girgaon, Phone: 2386 8065. Mobile: 9869074144. J.K. Advertisers, Hornimal Circle, Fort. Phone : 22663742. Stylus Arts, Dadar (W), Phone: 24304897 Promserve Vile Parle (W), Mobile : 9167778766 Mani's Agencies, Opp.G.P.O., Fort. Phone: 2263 00232. Mobile: 9892091257. *Venture Andheri (E) Phone : 61226000* Aaryan Publicity Dadar (E), Phone: 022-65881876 Mobile: 9320111876 Time Advertising, Matunga (W), Phone: 2446 6191 Anuja Media Andheri (W), Mobile: 9152895703 Vijaya Agencies, Dadar (W), Phone : 2422 5672. Mobile : 9920640689 Manjyot Ads, Currey Road (E) Phone: 24700338. Mobile: 9820460262. B. Y. Padhye Publici Dadar (W), Phone: 2422 9241/ 2422 0445. Bombay Publicity Andheri (W) Mobile: 9870703542 OM Sai Ram Advtg., Currery Road Mobile: 9967375573 DATEY Advertising, Datey Bhavan, Dadar (W. Mobole: 8452846979/ 9930949817 Carl Advertising, Andheri (W), Phone: 6696 3441 / 42. Pinto Advertising, Mazagaon, Phone: 23701070. Mobile: 9869040181. Achievers Media Bandra (W.), Phone: 22691584 Gauri Press Communicatio Andheri (E), Mobile: 9820069565/ 98200 Hook Advertainment Dadar Mobile : 8691800888

## $\Lambda$ (VIND SMALTSPACES

## ARVIND SMARTSPACES LIMITED

CIN: L45201GJ2008PLC055771

Regd. Off: 24, Government Servant's Society, Near Municipal Market. Off. C. G. Road. Navrangoura. Ahmedabad-380009. Tel.: +91 7968267000, Email: investor@arvindinfra.com Website: www.arvindsmartspaces.com

#### NOTICE OF POSTAL BALLOT (THROUGH REMOTE E-VOTING)

Notice is hereby given, pursuant to the provisions of Section 110 of the Companies Act, 2013 ('the Act') read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ('the Rules'), the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI LODR Regulations'), General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020, General Circular No. 22/2020 dated 15th June, 2020, General Circular No. 33/2020 dated 28th September, 2020, General Circular No. 39/2020 dated 31st December, 2020, General Circular No. 10/2021 dated 23th June, 2021, General Circular No. 20/2021 dated 8th December, 2021 and General Circular No. 3/2022 dated 5th May, 2022 issued by Ministry of Corporate Affairs ('the General Circulars') that the Company is seeking approval of members for the special business as set out in the Postal Ballot Notice dated 20th May, 2022 ("Postal Ballot Notice"). Members are informed that the Postal Ballot Notice along with relevant Explanatory Statement and e-voting instructions for remote e-voting have been sent to members who have registered their email addresses with the Company or Depositor Participant(s) on their registered e-mail addresses as on the cut-off date.

The Postal Ballot Notice has been sent to email addresses of those members whose names appeared in the Register of Members / List of Beneficial Owners as received from the National Securities Depository Limited ('NSDL') and Central Depository Services (India) Limited ('CDSL') as on Friday, 27th May, 2022 ("the Cut - Off Date"). The voting rights shall be reckoned on the paid-up value of the shares registered in the name of members as on the Cut - Off Date. A person who is not a member as on the Cut - Off Date should treat this notice for

Members should note that in terms of the General Circulars, no physical ballot form is being dispatched by the Company and the Members can cast their vote using remote

Pursuant to the General Circulars, Members whose email addresses were not registered with the Company or Depository Participant(s) as on the Cut - Off Date, are requested to register their email addresses by sending an email citing subject line as "ASL-Postal Ballot-Registration of e-mail Ids" to our RTA i.e. Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in or to the Company at investor@arvindinfra.com with name of registered shareholder(s), folio number(s) / DP Id(s) / Client Id(s) and No. of shares held from the email address they wish to register to enable them to exercise their vote(s) on the special business as set out in the Postal Ballot Notice through remote e-voting facility provided by NSDL. For details of the manner of casting voting through remote e-voting by the members holding shares in physical form or who have not registered their email addresses with the Company or Depository Participant(s), members are requested to refer instruction no. 7 of the Postal Ballot Notice.

In accordance with the provisions of Section 108 of the Act read with the Rules, the General Circulars and Regulation 44 of the SEBI LODR Regulations, the Company is providing facility its members to exercise their votes electronically in respect of item enlisted in the Postal Ballot Notice through the remote e-voting facility provided by NSDL

## Details of Postal Ballot Schedule:

Sr. No.	Particulars	Schedule
1	Date of Completion of dispatch of postal ballot notice	Wednesday, 1st June, 2022
2	2 Cut - off date for identification of voting rights of the members Friday, 27th May, 2022	
3	3 Date and time of commencement of remote e-voting Friday, 3 <sup>rd</sup> June, 2022 [09:00 a.m.]	
4	Date and time of end of remote e-voting	Saturday, 2 <sup>nd</sup> July, 2022 [05:00 p.m.]
5	Remote e-voting shall not be allowed beyond	Saturday, 2 <sup>nd</sup> July, 2022 [05:00 p.m.]
6 Scrutinizer Mr. Hitesh Buch, (CP No.: 8195),		Mr. Hitesh Buch, (CP No.: 8195),
		Proprietor, Hitesh Buch & Associates, Practicing Company Secretaries
7	Contact details of the person at NSDL responsible to address the grievances connected to e-voting	Ms. Pallavi Mahtre, Manager, email: evoting@nsdl.co.in or call on
		Toll free No.: 1800-1020-990 or 1800 22 44 30.

Members are informed that: (1) Members can vote only through remote e-voting facility provided by NSDL as no physical ballot form is being dispatched or will be accepted by the Company. (2) A member who has not received Postal Ballot Notice on their registered email address along with relevant Explanatory Statement and e-Voting instructions for remote e-Voting may obtain the same by sending an email to our RTA i.e. Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in and to the Company at investor@arvindinfra.com (3) A copy of the Postal Ballot Notice and the procedure for registration of email addresses of members are also available on the website of the Company at www.arvindsmartspaces.com The Postal Ballot Notice along with Explanatory Statement is also available on website of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) ("Stock Exchanges" where the equity shares of the Company are listed). (4) Mr. Hitesh Buch, (CP No.: 8195), Proprietor, Hitesh Buch & Associates, Practicing Company Secretaries has been appointed as Scrutinizer for conducting remote e-voting process in accordance with the law and in a fair and transparent manner. (5) For any queries/grievances, in relation to voting through electronic means, members may contact Registrar and Transfer Agent (RTA) i.e. Link Intime India Private Limited at hatmedabad@linkintime.co.in, the Scrutinizer at pcs.buchassociates@gmail.com or the Company at investor@arvindinfra.com. (6) The result of the voting by Postal Ballot (through remote bevoting) shall be declared on or before Tuesday, 5th July, 2022. The results declared and the Scrutinizer's Report shall be made available at the Registered Office of the Company and on the Company's website and on the website of NSDL at <a href="https://www.evoting.nsdl.com">www.evoting.nsdl.com</a> besides being communicated to the Stock Exchanges where the Company's shares are listed.

For Arvind SmartSpaces Limited

Prakash Makwana

Place: Ahmedabad Date: 1st June, 2022

 $\mathbf{M}$ 

#### ARVIND LIMITED (CIN: L17119GJ1931PLC000093)

Regd. Office: Naroda Road, Ahmedabad - 380025.

Phone: 079-68268000, Email: investor@arvind.in, Website: www.arvind.com NOTICE OF POSTAL BALLOT (THROUGH REMOTE E-VOTING)

Notice is hereby given, pursuant to the provisions of Section 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act"), read together with Rule 20 & 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("Rules") as amended from time to time and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015 ("Listing Regulations") and General Circular No. 14/2020 dated April 8, 2020, the General Circular No. 17/2020 dated April 13, 2020, the General Circular No. 22/2020 dated June 15, 2020, the General Circular No. 33/2020 dated September 28, 2020, the General Circular No. 39/2020 dated December 31, 2020, General Circular No. 10/2021 dated June 23, 2021, the General Circular No. 20/2021 dated December 8, 2021, and the General Circular No. 3/22 dated 5th May, 2022 issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars"), Secretarial Standard on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of India and other applicable laws and regulations, as amended from time to time (including any statutory modification(s) or re-enactment thereof for the time being in force), that the Company is seeking approval of members for the special business as set out in the postal ballot notice dated 18th May, 2022 ("Postal Ballot Notice"). Members are informed that the Postal Ballot Notice along with relevant Explanatory Statement and e-voting instructions for remote e-voting have been sent only by E-mail and completed on Wednesday, 1st June, 2022 to members who have registered their email addresses with the Company or Depository Participant(s) on their registered e-mail addresses as on the cut-off date i.e. Friday, 27th May, 2022.

The Postal Ballot Notice has been sent to email addresses of those members whose names appeared in the Register of Members / List of Beneficial Owners as received from the National Securities Depository Limited ('NSDL') and Central Depository Services (India) Limited ('CDSL') as on Friday, 27th May, 2022 ("the Cut - Off Date"). Accordingly, physical copy of the notice along with postal ballot form and prepaid business reply envelop have not been sent to the members for this postal ballot and members are required to communicate their assent or dissent only through the remote e-voting system. The voting rights shall be reckoned on the paid-up value of the shares registered in the name of members as on the Cut-Off Date. A person who is not a member as on the Cut - Off Date should treat this notice for information purpose only.

Pursuant to the General Circulars, Members whose email addresses were not registered with the Company or Depository Participant(s) as on the Cut - Off Date, are requested to register their email addresses by sending an email citing subject line as "AL - Postal Ballot - Registration of e-mail addresses" to our RTA i.e. Link Intime India Private Limited a ahmedabad@linkintime.co.in or to the Company at investor@arvind.in with name of registered shareholder(s), folio number(s) / DP Id(s) / Client Id(s) and No. of shares held to enable them to exercise their vote(s) on the special business as set out in the Postal Ballot Notice through remote e-voting facility provided by NSDL. For details of the manner of casting voting through remote e-voting by the members holding shares in physical form or who have not registered their email addresses with the Company or Depository Participant(s), members are requested to refer instruction no. 7 of the Postal Ballot Notice

In accordance with the provisions of Section 108 of the Act read with the Rules, the General Circulars and Regulation 44 of the SEBI LODR Regulations, the Company is providing facility to its members to exercise their votes electronically in respect of items enlisted in the Postal Ballot Notice through the remote e-voting facility provided by NSDL

Details of Postal Ballot Schedule:					
Sr. No.	Particulars	Schedule			
1	Date of Completion of dispatch of postal ballot notice	Wednesday, 1st June, 2022			
2	Cut - off date for identification of voting rights of the members	Friday, 27 <sup>th</sup> May, 2022			
3	Date and time of commencement of remote e-voting	Friday, 3 <sup>rd</sup> June, 2022 [09:00 a.m.]			
4	Date and time of end of remote e-voting	Saturday, 2 <sup>nd</sup> July, 2022 [05:00 p.m.]			
5	Remote e-voting shall not be allowed beyond	Saturday, 2 <sup>nd</sup> July, 2022 [05:00 p.m.]			
6	Scrutinizer	Mr. Hitesh Buch, (CP No.: 8195), Proprietor, Hitesh Buch & Associates, Practicing Company Secretaries			
7	Contact details of the person at NSDL responsible to address	Ms. Pallavi Mahtre, Manager, email: evoting@nsdl.co.in or call at Toll free No.: 1800-1020-990 or 1800 22			
	the grievances connected to e-voting	44 30			

Members are informed that: (1) Members can vote only through remote e-voting facility provided by NSDL as no physical ballot form is being dispatched or will be accepted by the Company. (2) A member who has not received Postal Ballot Notice on their registered email address along with relevant Explanatory Statement and e-Voting instructions for remote e-Voting may obtain the same by sending an email to our RTA i.e. Link Intime India Private Limited at <a href="mailto:ahmedabad@linkintime.co.in">ahmedabad@linkintime.co.in</a> and to the Company at <a href="mailto:investor@arvind.in">investor@arvind.in</a> (3) A copy of the Postal Ballot Notice and the procedure for registration of email addresses of members are also available on the website of the Company at www.arvind.com. The Posta Ballot Notice along with Explanatory Statement is also available on website of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) ("Stock Exchanges" where the equity shares of the Company are listed). (4) Mr. Hitesh Buch, (CP No.: 8195), Proprietor, Hitesh Buch & Associates, Practicing Company Secretaries has been appointed as Scrutinizer for conducting remote e-voting process in accordance with the law and in a fair and transparent manner. (5) For any queries/grievances, in relation to voting through electronic means, members may contact Registrar and Transfer Agent (RTA) i.e. Link Intime India Private Limited at <a href="mailto:ahmedabad@linkintime.co.in">ahmedabad@linkintime.co.in</a>, the Scrutinizer at pcs.buchassociates@gmail.com or the Company at investor@arvind.in. (6) The result of the voting by Postal Ballot (through remote e-voting) shall be declared within 2 working days from the closure of e-voting. The results declared and the Scrutinizer's Report shall be made available at the Registered Office of the Company and on Company's website and on the website of NSDL at www.evoting.nsdl.com besides being communicated to the Stock Exchanges where the Company's shares are listed.

By order of the Board For Arvind Limited

R. V. Bhimani , Company Secretary Membership No.A6738



#### **Motilal Oswal Home Finance Limited** CIN: U65923MH2013PLC248741

Regd. Office: Motilal Oswal Tower, Rahimtullah Sayani Road, Opposite Parel S T Depot, Prabhadevi, Mumbai - 400 025, Maharashtra, India. E-mail: hfquery@motilaloswal.com, Website: www.motilaloswalhf.com Tel: +91 8291889898; Fax: +91 22 5036 2365;

NOTICE OF NINTH ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH ELECTRONIC MODE

Notice is hereby given that

A) ANNUAL GENERAL MEETING:

The Ninth Annual General Meeting ("AGM") of the Members of Motilal Oswal Home Finance Limited ("the Company") is scheduled on Friday, June 24, 2022 at IST 4.00 p.m. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") facility in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") and Rules framed thereunder read with Circular dated April 8, 2020, April 13, 2020, May 5, 2020 and May 5, 2022 issued by the Ministry of Corporate Affairs

The Notice of the AGM along with Annual Report for the Financial Year 2021-22 is been sent through electronic mode (vide e-mail) on June 1, 2022 to those Members, whose names appear in the Register of Members / Beneficial Owners maintained by the Company / Depositories as on benpos date i.e. Friday, May 27, 2022 and whose e-mail addresses were registered with the Company / Depositories. The Notice and the Annual Report are also available on the website of the Company at www.motilaloswalhf.com and the Link Intime India Private Limited ("LIIPL") at https://instavote.linkintime.co.in.

B) PROCEDURE FOR JOINING THE AGM THROUGH VC / OAVM:

Members will be provided with a facility to attend the AGM through VC / OAVM through instancet platform of LIIPL. Members may access the same at https://instameet.linkintime.co.in. The link for VC / OAVM will be available 15 minutes before the scheduled time of AGM. Members participating through the VC / OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.

C) PROCEDURE FOR REMOTE E-VOTING AND E-VOTING DURING / AT THE AGM:

("MCA Circulars"), without the physical presence of the Members at a common venue.

In compliance with the provisions of Section 108 of the Act read with Rules made thereunder and other applicable provisions of the Act, Secretarial Standard on General Meetings ("SS-2") and as per MCA Circulars, the Company is offering "Remote e-voting facility" (e-voting from a place other than venue of the Meeting) prior to the date of AGM and "E-voting facility" during the AGM to its Members in respect of all businesses to be transacted at the AGM. For this purpose, the necessary arrangements have been made by the Company with LIIPL to facilitate Remote e-voting and E-voting. The brief details are

- The Member whose name appears in the Register of Members / Beneficial Owners maintained by the Depositories as on cut-off date i.e. Friday, June 17, 2022 will only be considered for the purpose of Remote e-voting and E-voting. Person(s) who is not Member as on cut-off date should treat Notice of the AGM for information purpose only.
- Members who are attending the AGM through VC / OAVM, can cast their vote during AGM electronically on the businesses specified in the notice of the AGM through E-voting facility. However, only those Members, who will be present in the AGM through VC / OAVM and have not casted their vote on the Resolutions through Remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through E-voting during the AGM. The Members who have exercised their right to vote by Remote e-voting may attend the AGM but shall not vote at the AGM.
- The Remote e-voting facility commences on Tuesday, June 21, 2022 at IST 9.00 a.m. and ends on Thursday, June 23. 2022 at IST 5.00 p.m. The Remote e-voting shall be disabled by LIIPL after aforesaid period.
- The Members who are holding shares in physical form or who have not registered their e-mail address with the Company / Depositories or any person who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as of the cut-off date, i.e. Friday, June 17, 2022 may obtain the User ID and password by sending a request at enotices@linkintime.co.in. However, if a non-individual Member is already registered with LIIPL for Remote e-voting and E-voting during AGM, then existing User ID and password can be used for casting vote.
- The detailed procedure pertaining to Remote e-voting and E-voting is provided in the Notice of the AGM.
- In the event of any grievance relating to Remote e-voting and E-voting, the Members may contact Mr. Nihar Kudaskar, Associate Technology Group, LIIPL, C-101, 1<sup>st</sup> Floor, 247 Park, Lal Bahadur Shastri Marg, Vikhroli (West), Mumbai -400083 or send an email to enotices@linkintime.co.in or call helpdesk: 022 4918 6000.

The Members who have not registered their email address and holding Equity Shares in Demat form are requested to register their e-mail address with the respective Depository Participant ("DP") and the Members holding Equity Shares in physical Form may get their e-mail addresses registered with the Company by sending the request at corpsec@motilaloswal.com. The Members are requested to provide details such as Name, Folio Number, Certificate number, PAN, mobile number and e-mail id, etc.

The Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM through VC / OAVM, manner of casting vote through Remote e-voting and E-voting during the AGM and also registering as speaker

For Motilal Oswal Home Finance Limited

Ritin Mawani

Place: Mumbai Date: June 1, 2022 Company Secretary & Compliance Officer



#### **CHEMPLAST SANMAR LIMITED** Regd: Office: 9, Cathedral Road, Chennai 600 086

CIN: L24230TN1985PLC011637 Phone: 044-28128500

Website: www.chemplastsanmar.com: Email: grd@sanmargroup.com

## PUBLIC NOTICE – 38th ANNUAL GENERAL MEETING

The 38th Annual General Meeting ("AGM") of Chemplast Sanmar Limited (CSL) will be held at 3.00 PM on Friday, the 24th June 2022 through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") facility in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the Rules made there under, read with circulars issued by Ministry of Corporate Affairs (MCA) and Securities and Exchange Board of India (SEBI). The VC / OAVM facility will be provided by KFin Technologies Limited to transact the businesses as set out in the Notice convening the AGM.

The e-copy of the Notice of the AGM along with the Annual Report for the Financial Year 2021-22 of the Company will be available on the website of the Company at www.chemplastsanmar.com, Websites of the Stock Exchanges i.e., BSE Limited & National Stock Exchange of India Limited, at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of the Company's Registrar and Share Transfer Agent, M/s. KFin Technologies Limited at <a href="https://evoting.kfintech.com/public/downloads.aspx">https://evoting.kfintech.com/public/downloads.aspx</a> (KFin).

Members can attend and participate in the Annual General Meeting through the VC/OAVM facility ONLY, the details of which will be provided by the Company in the Notice of the AGM. Members attending the Meeting through VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

The Notice of the Annual General Meeting along with the Annual Report has been sent only through electronic mode to those Members whose e-mail addresses are registered with the RTA / Depositories. Members who have not yet registered their email addresses are requested to update their e-mail id with their respective DP's to receive the login id and password for remote e-Voting /e-Voting at the AGM. The Company will not despatch physical copy of Notice of the AGM and the Annual Report to the Members in view of its green initiatives and the MCA Circulars. However the same shall be made available upon receipt of request from the Member(s), for the same in writing to the Company email id: (grd@sanmargroup.com) or the Registrar of Share Transfer Agent, KFin Technologies Limited email id: (einward.ris@kfintech.com).

In terms of Section 108 of the Companies Act 2013, applicable Rules thereon and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing the remote e-voting facility ("remote e-voting") of KFin Technologies Limited to all its Members to cast their votes on all Resolutions set out in the Notice convening the AGM of the Company. The remote e-voting will commence on 21st June 2022 from 9.00 AM (IST) and will end on 23rd June 2022 at 5.00 PM (IST). Additionally, the Company will also provide the facility of e-voting during the AGM. The voting rights of the members shall be in proportion to their shareholding in the company as on the cut-off date for e-voting i.e. 17th June, 2022. Detailed procedure for remote e-voting and e-voting has been provided in the Notice of the AGM. Dr. B Ravi, Managing Partner, M/s. B Ravi & Associates, Company Secretaries (Firm Registration No. P2016TN052400) will be the scrutinizer of the entire voting process.

Place: Chennai Date: 1st June 2022 For Chemplast Sanmar Limited M Raman Company Secretary & Compliance Officer Memb.No. ACS-6248





Place: Ahmedabad Date: 1st June, 2022









Notice hereby given that certificate(s) in respect of below mentioned Equity share of the M/S. CERA SANITARYWARE LIMITED (COMPANY) has/have been lost/misplaced/stolen and the holder(s) of the said share, Mr./Mrs MRUDULA DILIPKUMAR MARFATIA & DILIPKUMAR AMRATLAL MARFATIYA has/have applied to the company for issue of Duplicate share Certificate(s) in Lieu of the Original Share Certificate No. 10850-10851-10852-10853-10854 belongine to Folio No. 00005956. Any person having claims/objections in the said shares, should Communicate to the Company at the Registered Office of the Company within 15 days from the date of publication of this notice, failing which the Company shall proceed to issue Duplicate Share Certificates.

## <mark>्रिट्राचे रांजाब नै</mark>शनल बैंक **ए** punjab national bank

સર્કલ સસ્ત્ર ગાંધીનગર, પહેલો માળ, સેક્ટર - ૧૬, ધ-૪.**૫**, সাধীনগर - ૩८२०१६. Email:- cs8226@pnb.co.in

#### Appendix-IV [See Rule 8 (1)] કબજા નોટીસ (અચલિત મિલકતો માટે)

માથી, નીચે સહી કરનાર **પંજાબ નેશનલ બેંક, સર્કલ ઓફિસ, સસ્ત્ર ડિવિઝન, ગાંધીનગર - ૩૮૨૦૧૬** ન અધિકૃત અધિકારીએ સિક્ચોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્દ્ર ઓફ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની ધારા ૧૩(૧૨) સાથે વંચાતા નિયમ ૩ हેઠળ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના અંતર્ગત **તા. ૦૧.૦૩.૨૦૨૨** ના રોજ ડિમાન્ડ નોટીસ જારી કરેલ હતી જેમ કરજદાર/જામીનદારો/ ગીરોદારો **મેસર્સ સાંઈકૃપા પોલીમર્સ (પ્રોપ. - શ્રી અભિષેક નગીનદાસ શાહ) અને** જામીનદાર બધા કાયદેસરના વારસદારો સ્વ. શ્રી નગીનદાસ ભાઈચંદ શાહ ને ડિમાન્ડ નોટીસમ જણાવેલ રકમ રૂા. ૧૪,૦૮,૪७૩.૯૨ (રૂા. ચૌદ લાખ આઠ હજાર ચારસો તોત્તેર અને પૈસા બાણું માત્ર તા. ૨૮.૦૨.૨૦૨૨ લુંઘીના અને જ્યાં સુધી પૂરેપુરી રકમ ન ચૂકવ્યા ત્યાં સુધી વ્યાજ અને ખર્ચાઓ સાથૈની રકમસદર નોટીસ પ્રાપ્ત થયાની તારીખથી ૬૦ દિવસોમાં ચૂકવવા જણાવવામાં આવ્યું હતું.

કરજદાર/જામીનદારો /ગીરોદારો આ રકમ ચૂકવવામાં અસકળ રેકેલ છે, આથી કરજદાર/જામીનદાર/ ગીરોદાર અને જાહેર જનતાને જણાવવામાં આવે છે કે **તા. ૨૬.૦૫.૨૦૨૨** ના રોજ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ અંતર્ગત નિયમ ૮ ના ધારા ૧૩(૪) ના અંતર્ગત નીચે હસ્તાક્ષર કરેલ ખિધકારીએ પોતાના અધિકારથી નીચે દર્શાવેલ મિલકતોનો કબજો મેળવેલ છે.

કરજદાર/જામીનદારો/ગીરોદારને વિશેષરૂપે અને જાહેર જનતાને સામાન્ય રીતે અહીંથી ચેતવણી માપવાની કે નીચે દર્શાવેલ મિલક્તો અંગે કોઈ વ્યવહાર કરવો નહીં અને મિલક્તો અંગેનો કોઈપણ વ્યવહાર પં**જાબ નેશનલ બેંક**ની બાકી રકમ **રૂા. ૧૪,૦૮,૪७૩.૯૨ (રૂા. ચૌદ લાખ આઠ હજાર ચારસો તોત્તેર અને** પૈસા બાણું માત્ર) તા. ૨૮.૦૨.૨૦૨૨ સુધીના અને જથાં સુધી પૂરેપુરી રકમ ન ચૂકલ્યા ત્યાં સુધી વ્યાજ અને ખર્ચાઓ સાથૈની રકમના બોજાને આધિન રહેશે.

ગીરવે રાખેલ અસ્કથામતો આપેલા સમયમાં છોડાવવા અંગે કરજદારો /જામીનદારો /ગીરોદારોનં કાયદાન ોક્શન ૧૩ ના સબ-સેક્શન (૮) ની જોગવાઈ તરફ ધ્યાન દોરવામાં આવે છે.

ગીરો અચલિત મિલકતની વિગતો

રજીસ્ટર્ડ ગીરો રહેણાંક ઘર રેવેન્યુ સર્વે નં. ૧૯૪૩/પી, પ્લોટ નં. ૧૬/પી, સબ પ્લોટ નં. ૧૬/૨, લક્ષમી પાર્ક સોસાયટી, ધુધરી પાર્ક પાસે, સીતારામ બાગ સોસાયટી પાછળ, ઑફ ૮૦ કુટ રોડ, વઢવાણ સુરેન્દ્રનગર ક્ષેત્રફળ ૯૯.૮૮ રકે. મીટર્સ ની મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે. ચતુરસીમાઃ ઉત્તરઃ સંબ પ્લોટ નં. ૧૬/૩, દક્ષિણઃ સબ પ્લોટ નં. ૧૬/૧, પૂર્વઃ રોડ,પશ્ચિમઃ રેવેન્યુ સર્વે નં. ૧૯૪૪, ૧૯૪૯ અને ૧૯૫૦

તારીખ: ૨૬/૦૫/૨૦૨૨

અધિકૃત અધિકારી પંજાબ નેશનલ બેંક

## aurionpro 🌮

#### **AURIONPRO SOLUTIONS LIMITED**

CIN: L99999MH1997PLC111637 Registered Office: Synergia IT Park, Plot No-R-270, T.T.C. Industrial Estate, Near Rabale Police Station, Rabale, Navi Mumbai - 400701 **Ph:** +91 22 4040 7070, **Fax:** +91 22 4040 7080 Web: www.aurionpro.com E-mail: investor@aurionpro.com

#### **NOTICE TO SHAREHOLDERS**

[Pursuant to Section 124(6) of the Companies Act, 2013, read with the Companies Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules 2016]

This Notice is hereby given pursuant to the provisions of the Companies Act 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules 2016 as

amended from time to time ("the Rules"). Section 124(6) of the Companies Act, 2013, read with the rules inter alia provide for transfer of all shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more to the Investor Education and Protection Fund (IEPF) set

up by the Central Government. The Company has identified such shareholders who have not claimed dividend for more than seven consecutive years and has sent notices to their respective address available with Company. A list of such shareholders, who has not claimed dividends for more than seven consecutive years has also been published on the Company's website,

www.aurionpro.com under 'Investors Section'. The Members are requested to make a request to the Company Registrar and Transfer Agents on or before 10th October 2022 for claiming the unclaimed dividend so that the shares will not be get transferred to the IEPF. The Members may note that, if for whatsoeve reason if any member fails to claim the dividend for previous seven consecutive financial years before 10th October 2022 the Company will

It may also be noted that upon transfer of shares to IEPF, those shares and all benefits accruing on thereon, if any, can be claimed from the IEPF after following the procedure prescribed under the Rules.

transfer the shares to the IEPE without any further notice

For any clarification on the matter, please contact the Company's Registrar and Transfer Agents: M/s Bigshare Services Pvt Ltd., Office No S6-2, 6<sup>th</sup> floor, Pinnacle Business Park, Next to Ahura Centre, Mahakali Caves Road, Andheri (East), Mumbai - 400 093.

#### Registered Office

Synergia IT Park, Plot No-R-270, T.T.C. Industrial Estate Road, Near Rabale Police Station, Rabale Navi Mumbai - 400 701 CIN: L99999MH1997PLC111637 Contact No.: 91 22 4040 7070 Fax No.: 91 22 4040 7080

By Order of the Board For Aurionpro Solutions

S/d

E-mail: investor@aurionpro.com Website: www.aurionpro.com Ninad Kelkar Date: 1st June, 2022 Company Secretary इंडियन बैंक 🦝 Indian Bank 🛕 इलाहाबाद ALLAHABAD

हेरजान साहेज .

ઝોનલ ઓફિસ, "બી" બ્લોક, રૂદ્ધા આર્કેંડ, ૧૩૨ ફીટ, ડ્રાઇવ-ઇન-કોસ રોડ, મેમનગર, વાદ-૩૮૦૦૫૨ ફોન: ૦૭૯-૨૭૪૩૫૬૪૩, ૨૭૪૩૧૨૪ ફેક્સ : ૦૭૯-૨૭૪૩૯૬૪૮, ઇ-મેલ : zoahmedabad@indianbank.co.in

हेवाहारने विबङ्घत डिફोल्टर तरीङे वर्गीङ्गत ङरता विबङ्घत डिફोल्टर समीक्षा समितिना निर्धयनी क्षण ङरतो पत्र

૧) મે. ઈન્ફોર્સ્ડ ટેક એન્ડ માર્કેટીંગ (પ્રોપરાચટરશીપ ફર્મ, દેવાદાર)

3જો માળ, દિવાપલી રોન્ટર, જૂની હાઇકોર્ટની સામે, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત, પીન-૩૮૦૦૦ ર) શ્રી **હિમાંશુ અનિરુદ્ધ શુકલા (પ્રોપરાયટર, ગીરવેદાર અને જામીનદાર**) બી/૨૦૧, આંગન રેસિડેન્સી , શ્યામ સુંદર સોસાયટી પાસે , ઘાટલોડીયા , અમદાવાદ , ગુજરાત , પીન-૩૮૦૦૬ '

અમે તમને આથી જાણ કરીએ છીએ કે અમારી બેંકે તા. ૦૧.૦૭.૨૦૧૫ના આરબીઆઈના વિલકુલ ડિફોલ્ટ 2ના માસ્ટર સર્ક્યુલર મુજબ દેવાદાર ફર્મ મે. ઇન્ફોર્સ્ડ ટેક એન્ડ માર્કેટિંગ અને તેના પ્રોપરાયટર શ્રી હિમાંશુળ ਮ<mark>ਰ</mark>ਿરुદ્ધભાઈ શુક્લાને વિલકુલ ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત કર્યા છે. વિલકુલ ડિફોલ્ટર વર્ગીકરણની કાર્યવાત

विंवडुव डिझेट्टर समीक्षा समितियो २७.०३.२०१६ ना रोष योषायेवी तेनी पेठडमां नीरोनी माहित ાને તેમની સમક્ષ મુકવામાં આવેલા રેકોર્ડ્સ પર વિચાર કર્યો :

મે. ઇન્ફોર્મ્ડ ટેક એન્ડ માર્કેટિંગને ૦૭.૦૯.૨૦૧૬ ના રોજ રૂ1. ૪૦.૮૫ લાખની કિંમતની સેપરેશન મોડ્યુ હીટિંગ અને કૂલિંગની મશીનરી ખરીદવા માટે રા. ૩૦.૦૦ લાખની ટર્મ લોન મંજૂર કરવામાં આવી હતી

૧૮.૧૧.૨૦૧૬ ના અંતિમ ઉપયોગ ચકાસણીના અહેવાલ મુજબ, મશીનરી કે જેના માટે ટર્મ લોન મંજૂર કરવામાં આવી હતી, તે સંસ્થાપિત કરેલી મળી આવી હતી. ૧૫.૦૬.૨૦૧૭ ના રોજની શાખા અધિકારીઓની મુલાકાત દરમિયાન યુનિટ કાર્યરત જોવા મળ્યું હતું .

એફ્જાએમઓના તા.૧૬.૦૨.૨૦૧૯ પત્ર મુજબ , તા. ૧૯.૧૦.૨૦૧૮ અને તા. ૨૪.૦૧.૨૦૧૯ ની મુલાક દરમિયાન, યુનિટ બંધ હતું અને મશીનરીઓ ઉપલબ્ધ ન હતી.

બાપુનગર શાખા દ્વારા તા. ૨૫.૦૧.૨૦૧૯ ના પત્ર દ્વારા દેવાદારને યુનિટમાંથી મશીનરીઓ ક્યાં છે તે અં પૂછપરછ કરવામાં આવી હતી , હજી સુધી દેવાદાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી

-. ૧૫.૦૬ ૨૦૧૭ થી લોન ખાતામાં માત્ર રૂા. ૪.૫૫ લાખ જમા થયા છે, એટલે કે એ તારીખથી એનપીએવ તારીખ સુધી યુનિટ સંપૂર્ણ રીતે કાર્યરત હતું.

ું કર્યા કર્યા કર્યા કર્યા છે. આમ, તે સ્પષ્ટ છે કે દેવાદારે ટર્મ લોન સુરક્ષિત કરવાના હેતુસર સિક્ચોરિટી તરીકે બેંકને ચાર્જ કરવામાં આવેલ મશીનરીઓનો બેંકની જાણ વિના નિકાલ કર્યો છે અને લોન ખાતામાં સાપેક્ષ વેચાણની રકમ જમા કરાવી નથી. જામીનદાર, શ્રી મનોહરસિંહ રાજપૂર્ત oc.oc.૨૦૧૪ પછી ગેરંટી દસ્તાવેજો આપ્યા છે પરંતુ જામીનદાર બેંકના લેણાં ચુકવવાની કોઈ માંગ કરવામાં આવી નથી. આમ, આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ

જામીનદાર વિલકુલ ડિફોલ્ટર તરીકે ગણાવાને પાત્ર નથી. તમિતિએ વિચારણા કર્યા પછી, પુરાવાઓ/સામગ્રીના રેકોર્ડના આધારે પ્રાથમિક દ્રષ્ટિએ અભિપ્રાય લીધો હતો દે વેલકુલ ડિફોલ્ટર પરના આરળીઆઈના તા. ૦૧.૦૭.૨૦૧૫ ના માસ્ટર સર્ક્યુલરની મિલકતોના નિકાલની શરત ૨.૧.૩ (ડી) ના સંદર્ભમાં દેવાદા૨ ફર્મ મે. ઇન્ફોર્મ્ડ ટેક એન્ડ માર્કેટિંગ અને તેના પ્રોપ૨ાયટ૨ શ્રી હિમાંશુભ

અનિરુદ્ધભાઈ શુક્લાને મિલકતોના નિકાલ માટે વિલકુલ ડિફોલ્ટર્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવી શકે છે અન્ ઉપરોક્ત આધારો પર કારણદર્શક નોટિસ બન્ની કરવાની મંબુરી આપી હતી . 1. ०६.०४.२०१६ ना रोप हेवाहार इर्म भे. छन्झेर्म्ड टेंड એन्ड मार्डेटिंग अने तेना प्रोपरायटर ९

હૈમાંશુભાઈ અનિરુદ્ધભાઈ શુક્લાને કારણ દર્શક નોટિસ જારી કરવામાં આવી હતી તા. ૦૬ .૦૪.૨૦૧૯ ના રોજની કારણ દર્શક નોટિસના જવાબમાં, તેમની પાસેથી કોઈ જવાબ/પ્રતિનિધિત

તા. ૦૭.૦૯.૨૦૧૯ ના રોજ વિલકુલ ડિફોલ્ટર સમીક્ષા સમિતિ(ડબ્લ્યુડીએસસી) બોલાવવામાં આવી હત ાને તા. ૦૧ .૦૭.૨૦૧૫ ના આરબીઆઈના વિલકુલ ડિફોલ્ટર પરના માસ્ટર સર્ક્યુલર અનુસાર દેવાદાર ફર .. ઇન્ફોર્મ્ડ ટેક એન્ડ માર્કેટિંગ અને તેના પ્રોપરાયટર શ્રી હિમાંશુભાઈ અનિરુદ્ધભાઈ શુક્લાને વિલફુલ

ડિફોલ્ટર તરીકે જાહેર કરતો આદેશ પસાર કર્યો હતો . મા આદેશની જાણ દેવાદાર ફર્મ મે. ઇન્ફોર્સ્ડ ટેક એન્ડ માર્કેટિંગ અને તેના પ્રોપરાયટર શ્રી હિમાંશૂભ ાનિરુદ્ધભાઈ શુકલાને તા. ૦૭.૦૯.૨૦૧૯ ના પત્ર દ્વારા કરવામાં આવી હતી અને તેમની રજ્આત , બે કોઠ ોચ તો તે જમાં કરાવવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો હતો .

રશિત આદેશ તેમને આપતામાં આવ્યો હતો અને તેમની પાસેશી કોઈ જવાબ/પ્રતિનિધિતા માણો નથી વિલકુલ ડિફોલ્ટર સમીક્ષા સમિતિની - તા. ૦૨.૦૨.૨૦૨૨ ના રોજ બેઠકઃ

વેલકુલ ડિફોલ્ટર સમીક્ષા સમિતિ(ડળ્વ્યુડીએસસી) નો તા. ૦૭.૦૯ ૨૦૧૯નો આદેશ વિલકુલ ડિફોલ્ટ સમીક્ષા સમિતિ સમક્ષ મૂર્ત્વાંકન અને આગળના આદેશો માટે મૂકવામાં આવ્યો હતો.

વેલકુલ ડિફોલ્ટર સમીક્ષા સમિતિએ તા. ૦૨.૦૨.૨૦૨૨ ના રોજે કરવામાં આવેલી તેની બેઠકમાં પુનઃસમીદ કરીને હકીકતો/પુરાવાઓ/સામગ્રી દરતાવેજોને ધ્યાનમાં લીધા પછી વિલફુલ ડિફોલ્ટર પરના આરબીઆઈન ता. ०९.०७.२०९५ ना भास्टर सर्झ्वरनी भिवडतोना निडावनी शरत - २.१.३ (डी) ना संदर्भः પ્લ્યુડીએસસીના તા. ૦૭.૦૯.૨૦૧૯ના દેવાદાર ફર્મ મે. ઇન્ફોર્મ્ડ ટેક એન્ડ માર્કેટિંગ અને તેના પ્રોપરાયટ શ્રી હિંમાંશુભાઈ અનિરુદ્ધભાઈ શુક્લાને મિલકતોના નિકાલ માટે વિલફુલ ડિફોલ્ટર્સ તરીકે જાહેર કરત

ડેપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, આથી અમે તમને "વિલકુલ ડિફોલ્ટર" તરીકે વર્ગીકૃત કરવા નેર્ણયની જાણ કરીએ છીએ

નોંધ : વિવાદની સ્થિતીમાં અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે.

#### **SCANPOINT GEOMATICS LIMITED**

Regd. Office: 9, Mahakant Complex, Opp. V. S. Hospital, Ashram Road, A'bad - 380006 Corporate Office: 12, Abhishree Complex Park, Ambli-Bopal Road, A'bad - 380058. CIN: 1.22219GJ1992PLC017073 Ph.: +91-2717-297096/98 | email: cs@sgligis.com | website: www.sgligis.com

NOTICE OF THE EXTRA ORDINARY GENERAL MEETING NOTICE is hereby given that the Extra Ordinary General Meeting (EGM) o Members of **SCANPOINT GEOMATICS LIMITED** will be held on Tuesday, June 28, 2022 at 12.30 PM through Video Conference ("VC\*)/Other Audio Visual Means ('0AVM'), to transact the business set out in the notice for the EGM ("Notice of EGM') in compliance with applicable provisions of the Companies Act, 2012 required the transaction of the Companies Act, 2012 required the set of the Act, 2012 required th 2013 read with rules issued thereunder, and MCA issued General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2020 dated May 5, 2020, General Circular No. 22/2020 dated June 15, 2020, General Circular No. 33/2020 dated September 28, 2020 General Circular No. 39/2020 dated December 31,2020 and General Circular No. SEBI/HO/CFD/CMD1/CIRP/2020/11 dated December 14, 2021 ("MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CMD1/CIRP/ 2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 issued by the Securities Exchange Board of India ("SEBI Circulars"), without the personal presence of the members at the meeting, to transact the businesses, as set out in the Notice convenient GM circulated for convenient the FGM. the Notice convening EGM circulated for convening the EGM

The Company has sent the Notice convening EGM on June 01, 2022 through electronic mode to the Members whose email addresses are registered with the Company and/or Depositories in accordance with aforesaid MČA Circulars and SEBI Circulars. The requirement of sending physical copies have been dispensed with vide the MCA Circulars and SEBI Circulars. Notice convening EGM is also available on the website of the Company at www.sgligis.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Members are provided with the facility to cast their votes on all resolution as set forth in the Notice convening EGM using electronic voting system (e-voting) provided by NSDL. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on 21st June, 2022 ('Cut-off date').

In case Member(s) have not registered their e-mail addresses with the Company/Depository, please follow the below instructions to register e-mai address for obtaining login details for e-voting.

a. For members holding shares in Physical mode - please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (selfattested scanned copy of Aadhar Card) by e-mail to cs@sgligis.co

b. Members holding shares in Demat mode can get their E-mail ID registered by contacting their respective Depository Participant or by e-mail to cs@sgligis.com with details of DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar

Members holding shares in either physical form or in dematerialized form as on the Cut-off date, may cast their vote electronically on the special business matters set out in the Notice through remote e-voting of NSDL. Members are informed that:

a. All the special business matters set out in the Notice will be transacted through oting by electronic means only,

b. The remote e-voting shall commence on Saturday, June 25, 2022 at 9.00 a.m. ST and shall end on Monday, June 27, 2022 at 5.00 p.m. IST.

 Any person who becomes a member of the Company after the date of sending the notice of this EGM and holding shares as on the cut-off date, may obtain the login ID and password by sending a request to evoting@nsdl.co.in or However, if the person is already registered with NSDL for remote e-voting, then the existing login ID and password may be used to cast the vote.

d. Members will not be able to cast their vote electronically beyond the date and ime mentioned above and the remote e-voting module shall be disabled for voting by NSDL thereafter.

. Once the vote on a resolution is cast by the member, he/she shall not be allower to change it subsequently or cast the vote again.

. Members who have voted through remote e-voting will be eligible to attend the EGM. However, they will not be eligible to vote at the EGM.

g. Only those Members, who will be present in the EGM through VC/OAVM facility and have not cast their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system in the EGM.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no. 1800 1020 990 and 1800 22 44 30 or send a request to (Kautilya Joshi) at evoting@nsdl.co.in. The details of EGM are available on the website of the Company at www.sgligis.com, NSDL at www.evoting.nsdl.com and BSE Limited at

For Scanpoint Geomatics Limited Sd/- Kantilal Ladani, Date: 01/06/2022 DIN No: 00016171



## અરવિંદ લીમીટેડ

(CIN: L17119GJ1931PLC000093)

**રજીસ્ટર્ડ ઓફીસ:** નરોડા રોડ, અમદાવાદ-૩૮૦૦૨૫.

ફોન: ૦૭૯-૬૮૨૬૮૦૦૦, ઇમેઇલ: investor@arvind.in વેબસાઇટ: www.arvind.com

## પોસ્ટલ બેલટની નોટીસ (રીમોટ ઈ–વોટીંગ મારફત)

આથી નોટીસ આપવામાં આવે છે કે, કંપની કાયદા, ૨૦૧૩ ('કાયદો') ની કલમ ૧૦૮, ૧૧૦ તેમજ અન્ય લાગુ પડતી જોગવાઇઓ સાથે વંચાતા કંપની ('વ્યવસ્થાપન અને પ્રશાસન')નિયમો, ૨૦૧૪ (નિયમો)ના નિયમ ૨૦ અને ૨૨, સિક્યોરીટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને પ્રિકલોઝર રીક્વાયરમેન્ટસ) નિયમનો, ૨૦૧૫ (**'લિસ્ટીંગ રેગ્યુલેશન્સ')** અને કોર્પોરેટ અર્ફર્સ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા જનરલ સરક્યુલર નં.૧૪/૨૦૨૦, તારીખ ૮મી એપ્રિલ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં.૧૭/૨૦૨૦, તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨૨/૨૦૨૦, તારીખ ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩૩/૨૦૨૦, તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩૯/૨૦૨૦, તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૧૦/૨૦૨૧ તારીખ ૨૩ જુન, ૨૦૨૧, સરક્યુલર નં. ૨૦/૨૦૨૧ તારીખ ૮ ડિસેમ્બર, ૨૦૨૧ અને જનરલ સસ્ક્યુલર નં. ૩/૨૨ તારીખ પ મે, ૨૦૨૨ (**'એમસીએ સરક્યુલર્સ')**, ઇન્સ્ટીટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ સામાન્ય સભાઓના સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ (એસએસ૨) અને અન્ય લાગુ કાયદાઓ અને નિયમનો, સમયાનુંસાર કરાયેલ સુધારા મુજબ (સમયે સમયે કરાયેલ કોઇપણ કાનુની ફેરફાર(રો) અથવાતેના પુર્નઅમલીકરણ) અન્વયે કંપનીએ તારીખ ૧૮ મે, ૨૦૨૨ ની પોસ્ટલ બેલટ નોટીસમાં જણાવેલ ખાસ કામકાજ માટે સભ્યોની મંજુરી માંગેલ છે. સભ્યોને જાણ કરવામાં આવે છે કે પોસ્ટલ બેલટ નોટીસ તેમજ સંબંધિત ખુલાસા નિવેદનો અને રીમોટ છ-વોટીંગ ઢારા મત આપવાની સુચનાઓ એવા સભ્યોને છમેછલ ઢારા મોકલવાની પ્રક્રિયા બુધવાર, ૧ જુન, ૨૦૨૨ના રોજ પૂર્ણ કરેલ છે કે જેમના નામની યાદી કટ-ઓક ડેટ એટલે કે શુક્રવાર, ૨૭ મે, ૨૦૨૨ ના રોજ કંપની અથવા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટન

આથી સભ્યોને જાણ કરવામા આવે છે કે, જેમના નામ શુક્રવાર, ૨૭ મે, ૨૦૨૨ ("કટ-ઓફ ડેટ") ના રોજ રજીસ્ટર ઓફ મેમ્બર્સનેશનલ સિક્યોરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ ('એનએસ ઊએલ') અને સેન્ટલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઇન્ડિયા) લીમીટેડ ('સી.ઊએસએલ') પાસેથી મળેલ બેનિકિસિય ઓનર્સની યાદીમાં આવ્યા છે તેમને ઇમેઇલ દ્વારા પોસ્ટલ બેલટ નોટીસ મોકલવામાં આવી છે. **નોટીસની ફિઝિકલ કોપી તેમજ પોસ્ટલ બેલોટ ફોર્મ અને પ્રિપેઇડ બિઝનેશ રીપ્લાય એન્વેલોપ આ પોસ્ટલ બેલોટ માટે સભ્યોને મોકલવામાં આવ્યા નથી અને સભ્યોએ ફક્ત રીમોટ છ-વોટીંગ પદ્ધતિ મારફત તેમની સમંતિ અથવા અસંમતિની જાણ કરવી છટ.** કટ-ઓફ ડેટના રોજ સભ્યોના નામે રજીસ્ટર્ડ શેરોની ભરપાઇ થયેલ મુડી પર મતના હકોની ગણતરી થશે. જેઓ કટ-ઓફ ડેટના રોજ કંપનીના સભ્યો ન હતા તેઓ માટે આ નોટીસ ફક્ત માહિતીના હેતુસર લેવાની રહેશે.

જનરલ સરક્યુલર્સના આધારે, કર-ઓફ ડેટના રોજ જે સભ્યોના ઇમેઇલ એડ્રેસ કંપની અથવા ડીપોઝીટરી પાર્ટીશીપન્ટની યાદીમાં ન હતા તેવા સભ્યો કંપનીના આરટીએ એટલે કે લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડને ahmedabad@linkintime.co.in અથવા કંપનીનો investor@arvind.in પર ઇમેઇલ કરીને એનએસડીએલ દ્વારા પુરી પડાયેલ રીમોટ ઇ-વોટીંગ સવલત મારફત પોસ્ટલ બેલટમાં જણાવેલ ખાસ કામકાજ પર તેમના મત આપવા માટે પોતાના ઇમેઇલ રજીસ્ટર્ડ કરાવી શકે છે. આ રજીસ્ટ્રેશન માટે સભ્યોએ પોતાની જરૂરી વિગતો જેવી કે રજીસ્ટર્ડ સભ્યનું નામ, ફોલિયો નંબર/ડીપી આઇડી/કલાઇન્ટ આઇડી અને શેરોની સંખ્યા ઇમેઇલ દ્વારા ''એએલ - પોસ્ટલ બેલટ - ઇમેઇલ એડ્સ રજીસ્ટ્રેશન" ના શીર્ષક હેઠળ આપવાની રહેશે. ફ્રિઝિકલ શેરધારકો અને એવા સભ્યો કે જેમના ઇમેઇલ એડ્રેસ કંપની અથવા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ પાસે નોંધાયેલ નથી, તેવા સભ્યો પોસ્ટલ બેલટ નોટીસની સુચના નં. ૭ મુજબ રીમોટ ઇ-વોટીંગથી મત આપી શકે છે

કાયદાની કલમ ૧૦૮ ની જોગવાઇઓ સાથે વંચાતા નિયમો, જનરલ સરક્યુલર્સ અને સેબી એલઓડીઆરના નિયમન ૪૪ મુજબ, કંપની તેના સભ્યોને એનએસડીએલ દ્વારા પુરી પડાયેલ રીમોટ ઇ-વોટીંગ દ્વારા પોસ્ટલ બેલોટ નોટીસમાં જણાવેલ વિગતોના સંબંધમાં ઇલેક્ટ્રોનિક રીતે તેમના મતો આપવા માટે તેમના સભ્યોને સવલત પુરી પાડી રહી છે

પોસ્ટલ બેલટની વિગતો

પાન્ડન મનડમાં પ્રમાત				
ક્રમ	વિગતો	સુચી		
۹.	પોસ્ટલ બેલટ નોટીસની રવાનગી પુર્ણ કર્યાની તારીખ	બુધવાર, ૧ જુન, ૨૦૨૨		
₹.	સભ્યોના મતદાન હકોની ઓળખ માટે કટ–ઓફ તારીખ	શુક્રવાર, ૨૭ મે, ૨૦૨૨		
3.	રીમોટ ઈ–વોટીંગની શરૂઆતની તારીખ અને સમય	શુક્રવાર, ૩ જુન, ૨૦૨૨ (સવારે ૦૯: ૦૦ વાગ્યે)		
٧.	રીમોટ ઈ-વોટીંગની સમાપ્તિની તારીખ અને સમય	શનિવાર, ર જુલાઇ, ૨૦૨૨ (સાંજે ૦૫:૦૦ વાગ્યે)		
ч.	રીમોટ ઈ–વોટીંગની પ્રાપ્યતાની સીમા	શનિવાર, ર જુલાઇ, ૨૦૨૨ (સાંજે ૦૫:૦૦ વાગ્યે)		
ξ.	સ્ક્રુટીનાઈઝર	શ્રી હિતેષ બુચ (સીપી નંબર : ૮૧૯૫), પ્રોપરાઇટર, હિતેષ બુચ એન્ડ એસોસિચેટ્સ, વ્યવસાચિક કંપની સચીવ		
٥.	ઈ–વોટીંગ સાથે સંકળાચેલ ફરિયાદો જણાવવા માટે	શ્રીમતી પક્ષવી માત્રે, પ્રબંધક, ઇમેઇલ : <u>evoting@nsdl.co.in</u>		
	એનએસડીએલ ખાતે જ્વાબદાર વ્યક્તિની સંપર્ક વિગતો	ટોલ ફ્રી નં. : ૧૮૦૦-૧૦૨૦-૯૬૦ અથવા ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦		

આથી તમામ સભ્યોને જાણ કરવામા આવે છે કે, (૧) સભ્યો ફક્ત એનએસડીએલ દ્વારા અપાયેલ રીમોટ ઇ-વોટીંગ સુવિધા દ્વારા જ મત આપી શકે છે કારણકે, કોઇ પોસ્ટલ બેલટ ફોર્મ રવાના કર્યા નથી અને કંપની દ્વારા સ્વીકારવામાં આવશે નહી. (૨) સભ્યો જેમને તેમના રજીસ્ટર્ડ ઇમેઇલ એડ્રેસ પર પોસ્ટલ બેલટ નોટીસ તેમજ સબંધિત ખુલાસા નિવેદનો અને રીમોટ ઇ-વોટીંગની સુચનાઓ મળી નથી તેઓ અમારા આરટીએ એટલે કે લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડને <u>ahmedabad@linkintime.co.in</u> અથવા <u>investor@arvind.in</u> પર ઇમેઇલ મોકલીને મેળવી શકે છે. (૩) પોસ્ટલ બેલટ નોટીસની નકલ અને સભ્યોના ઇમેઇલ એડ્રેસ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કંપનીની વેબસાઇટ <u>www.arvind.com</u> પર પણ ઉપલબ્ધ છે. પોસ્ટલ બેલટ નોટીસ તેમજ ખુલાસા નિવેદનો બીએસઇ લીમીટેડ (<u>www.bseindia.com</u>) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડ (<u>www.nseindia.com</u>) ની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. (સ્ટોક એક્સચેન્જો જેમાં કંપનીના ઇક્વીટી શેરો લીસ્ટેડ છે.) (૪) શ્રી હિતેશ બુચ (સીપી નં. : ૮૧૯૫), પ્રોપરાઇટર, હિતેશ બુચ એન્ડ એસોસિયેટ્સ, વ્યવસાયિક કંપની સચીવની કાનુન મુજબ યોગ્ય અને પારદર્શક પદ્ધતિમાં રીમોટ ઇ-વોટીંગ/પોસ્ટલ બેલટનું સંચાલન કરવા માટે સ્કુટીનાઇઝર તરીકે નિમણુંક કરવામા આવી છે. (૫) ઇલેક્ટ્રોનિક માધ્યમોથી વોટીંગને સબંધિત કોઇપણ પુછપરછ/ફરિયાદ માટે સભ્યો આરટીએ એટલે કે લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડનો <u>ahmedabad@linkintime.co.in,</u> સ્ક્રુટીનાઇઝરનો <u>pcs.buchassociates@gmail.com</u> અને કંપનીનો <u>investor@arvind.in</u> પર સંપર્ક કરી શકે છે. (૬)પોસ્ટલ બેલટ (રીમોટ ઇ-વોટીંગ મારફત) દ્વારા વોટીંગના પરિણામો ઇ-વોટીંગ પુર્ણ થયાની તારીખથી બે ચાલુ દિવસો બાદ જારી કરવામાં આવશે. જારી કરેલ પરિણામો અને સ્કુટીનાઇઝરનો અહેવાલ કંપનીની રજીસ્ટર્ડ ઓફીસે અને કંપનીની વેબસાઇટ પર અને એનએસડીએલની વેબસાઇટ <u>www.evoting.nsdl.com</u> પર પણ ઉપલબ્ધ રહેશે. આ સિવાય સ્ટોક એક્સચેન્જ જેમાં કંપનીના શેરો લીસ્ટેડ છે તેને પણ જાણ કરવામાં આવશે.

> બોર્ડના આદેશથી અરવિંદ લીમીટેડ વતી આર.વી. ભીમાણી, કંપની સચિવ

> > મેમ્બરશીપ નંબર : એ૬૭૩૮

સ્થળ: અમદાવાદ તારીખ: ૧ જુન, ૨૦૨૨

Arvind smartspaces

## અરવિંદ સ્માર્ટસ્પેસીસ લીમીટેડ

CIN: L45201GJ2008PLC055771

**રજીસ્ટર્ડ ઓફીસઃ** ૨૪, ગર્વમેન્ટ સર્વન્ટ્સ સોસાચટી, મ્યુનિસિપલ માર્કેટ પાસે, ઓફ સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ–૩૮૦૦૦૯. ફોન : +૯૧ ૭૯ ૬૮૨૬૭૦૦૦, **ઇમેઇલ**: <u>investor@arvindinfra.com</u> વેબસાઇટ: <u>www.arvindsmartspaces.com</u>

## પોસ્ટલ બેલટની નોટીસ (રીમો<u>ટ</u> ઈ-વોટીંગ મારફત)

થી નોટીસ આપવામાં આવે છે કે, કંપની કાયદા, ૨૦૧૩(**'કાયદ્યે')** ની કલમ ૧૧૦ ની જોગવાઇઓ સાથે વંચાતા કંપની **('વ્યવસ્થાપન અને પ્રશાસન')** નિયમો, ૨૦૧૪ (નિયમો) ના નિયમ ૨૦અને ૨૨, સિક્યોરીટીઝઅને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટીં બોબ્લીગેશન્સ અને સ્ત્રિક્લોઝર રીક્વાયરમેન્ટસ) નિયમનો, ૨૦૧૫ **('સેબી એલઓડીઆર રેગ્યુલેશન્સ')**અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ક્ષારા જારી કરવામાં આવેલા જનરલ સરક્યુલર નં. ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૨૨/૨૦૨૦ તારીખ ૧૫ જુન, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩૩/૨૦૨૦ તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૩૯/૨૦૨૦ તારીખ ૩૧ સ્મ્રિમ્બર, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૧૦/૨૦૨૧ તારીખ ૨૩ જુન, ૨૦૨૧, જનરલ સરક્યુલર નં. ૨૦/૨૦૨૧ તારીખ ૮ ડિસેમ્બર, ૨૦૨૧ અને જનરલ સરક્યુલર નં. ૩/૨૦૨૨ તારીખ ૫ મે, ૨૦૨૨ (**'જનરલ સરક્યુલર્સ')** અન્વયે કંપનીએ તારીખ ૨૦ મે, ૨૦૨૨ ની પોસ્ટલ બેલટ નોટીસમાં જણાવેલ ખાસ કામકાજ માટે સભ્યોની મંજુરી માંગેલ છે. સભ્યોને જાણ કરવામાં આવે છે કે પોસ્ટલ બેલટ નોટીસ તેમજ સબંધિત ખુલાસા નિવેદનો અને રીમોટ ઇ-વોટીંગ દ્વારા મત આપવાની સુચનાઓ એવા સભ્યોને ઇમેઇલ દ્વારા મોકલેલ છે કે જેમના નામની યાદી કટ-

આથી સભ્યોને જાણ કરવામા આવે છે કે, જેમના નામ શકવાર. ૨૭ મે. ૨૦૨૨ ("ક્ટ-ઓક ડેટ")ના રોજ રજીસ્ટર ઓક મેમ્બર્સ/નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ ('એનએસ ઊએલ') અને સેન્ટલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઇન્ડિયા) લીમીટેડ ('સીઊએસએલ') પાસેથી મળેલ બેનિફિસિયલ ઓનર્સની યાદીમાં આવ્યા છે તેમને ઇમેઇલ દ્વારા પોસ્ટલ બેલટ નોટીસ મોકલવામાં આવી છે. કટ–ઓફ ડેટના રોજ સભ્યોના નામે રજીસ્ટર્ડ શેરોની ભરપાઇ થયેલ મુડી પર મતના હકોની ગણતરી થશે. જેઓ કટ–ઓફ ડેટના રોજ કંપનીન સભ્યો ન હતા તેઓ માટે આ નોટીસ કક્ત માહિતીના હેતસર લેવાની રહેશે.

મભ્યોએ ખાસ નોંધ લેવી કે જનરલ સરક્યુલર્સના આધારે કંપનીએ પોસ્ટલ બેલટ ફોર્મ યોકલેલા નથી અને સભ્યો ફક્ત રીમોટ ઈ-વોટીંગથી જ મત આપી શકશે.

જનરલ સરક્યલર્સના આધારે, કટ-ઓક ડેટના રોજ જે સભ્યોના ઇમેઇલ એડ્રેસ કંપની અથવા ડીપોઝીટરી પાર્ટીશીપન્ટની યાદીમાં ન હતા તેવા સભ્યો કંપનીના આરટીએ એટલે કે લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડને <u>ahmedabad@linkintime.co.in</u> અથવા કંપનીને <u>investor@arvindinfra.com</u> પર ઇમેઇલ કરીને પોસ્ટલ બેલટમા જણાવેલ ખાસ કામકાજ પર તેમના મત આપવા માટે પોતાના ઇમેઇલ રજીસ્ટર્ડ કરાવી શકે છે. આ રજીસ્ટ્રેશન માટે સભ્યોએ પોતાની જરૂરી વિગતો જેવી કે રજીસ્ટર્ડ સભ્યનું નામ, ફ્રેલિયો નંબર/ડીપી આઇડી/કલાઇન્ટ આઇડી અને શેરોની સંખ્યા ઇમેઇલ દ્વારા ''એએસએલ – પોસ્ટલ બેલટ – ઇમેઇલ એડ્રસ રજીસ્ટ્રેશન" ના શીર્ષક હેઠળ આપવાની રહેશે. ફિઝિકલ શેરધારકો અને એવા સભ્યો કે જેમના ઇમેઇલ એડ્રેસ કંપની અથવા ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ પાસે નોંધાયેલ નથી, તેવા સભ્યો પોસ્ટલ બેલટ નોટીસની સુચના નં. ૭ મુજબ રીમોટ ઇ-વોટીંગથી મત આપી શકે છે.

કાયદાની કલમ ૧૦૮ ની જોગવાઇઓ સાથે વંચાતા નિયમો, જનરલ સરક્યુલર્સ અને સેબી એલઓડીઆરના નિયમન ૪૪ મુજબ, કંપની તેના સભ્યોને એનએસડીએલ દ્વારા પુરી પડાયેલ રીમોટ ઇ-વોટીંગ દ્વારા પોસ્ટલ બેલોટ નોટીસમાં જણાવેલ વિગતોના સંબંધમાં ઇલેક્ટ્રોનિક રીતે તેમના મતો આપવા માટે તેમના સભ્યોને સવલત પુરી પાડી રહી છે. પોસ્ટલ બેલટની વિગતો:

Wood was the same				
	ક્રમ	વિગતો	સુચી	
	٩.	પોસ્ટલ બેલટ નોટીસની રવાનગી પુર્ણ કર્ચાની તારીખ	બુધવાર, ૧ જુન, ૨૦૨૨	
	ર.	સભ્યોના મતદાન હકોની ઓળખ માટે કટ–ઓફ તારીખ	શુક્રવાર, ૨૭ મે, ૨૦૨૨	
	3.	રીમોટ ઈ–વોટીંગની શરૂઆતની તારીખ અને સમય	શુક્રવાર, ૩ જુન, ૨૦૨૨ (સવારે ૦૯.૦૦ વાગ્યે)	
	٧.	રીમોટ ઈ–વોટીંગની સમાપ્તિની તારીખ અને સમય	શનિવાર, ૨ જુલાઇ, ૨૦૨૨ (સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી). ત્યારબાદ રિમોટ ઇ-વોટીંગની મંજુરી મળશે નહીં	
	ч.	સ્ક્રુટીનાઈઝ <b>ર</b>	શ્રી હિતેષ બુચ (સીપી નંબર : ૮૧૯૫), પ્રોપરાઇટર, હિતેષ બુચ અને એસોસિચેટ્સ, વ્યવસાયિક કંપની સચીવ	
	ξ.	ઈ–વોટીંગ સાથે સંકળાચેલ ફરિયાદો જણાવવા માટે	શ્રીમતી પક્ષવી માત્રે, પ્રબંધક, ઇમેઇલ : <u>evoting@nsdl.co.in</u>	
		એનએસડીએલ ખાતે જવાબદાર વ્યક્તિની સંપર્ક વિગતો	ટોલ ફ્રી નં. : ૧૮૦૦–૧૦૨૦–૯૯૦ અથવા ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦	

આથી તમામ સભ્યોને જાણ કરવામા આવે છે કે, (૧) સભ્યો ફક્ત એનએસડીએલ દ્વારા અપાયેલ રીમોટ ૭-વોટીંગ સુવિધા દ્વારા જ મત આપી શકે છે કારણકે, કોઇ પોસ્ટલ બેલટ ફોર્મ રવાના કર્યા નથી અને કંપની દ્વારા સ્વીકારવામાં આવશે નહી. (૨) સભ્યો જેમને તેમના રજીસ્ટર્ડ ઇમેઇલ એડ્રેસ પર પોસ્ટલ બેલટ નોટીસ તેમજ સબંધિત ખુલાસા નિવેદનો અને રીમોટ ઇ-વોટીંગની સુચનાઓ મળી નથી તેઓ અમારા આરટીએ એટલે કે લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડને <u>ahmedabad@linkintime.co.in</u> બથવા <u>investor@arvindinfra.com</u> પર ઇમેઇલ મોકલીને મેળવી શકે છે. (૩) પોસ્ટલ બેલટ નોટીસની નકલ અને સભ્યોના ઇમેઇલ એડ્રેસ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કંપનીની વેબસાઇટ <u>www.arvindsmartspaces.com</u> પર ઉપલબ્ધ છે. પોસ્ટલ બેલટ નોટીસ તેમજ ખુલાસા નિવેદનો બીએસઇ લીમીટેડ (www.bseindia.com) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડ (www.nseindia.com) ની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. (**''સ્ટોક એક્સચેન્જો ''** જેમાં કંપનીના ઇક્વિટી શેરો લીસ્ટેડ છે). (૪) શ્રી હિતેશ બુચ (સીપી નં. : ૮૧૯૫), પ્રોપરાઇટર, હિતેશ બુચ એન્ડ એસોસિયેટ્સ, વ્યવસાયિક કંપની સચીવની કાનુન મુજબ યોગ્ય અને પારદર્શક પદ્ધતિમાં રીમોટ ઇ-વોટીંગ/પોસ્ટલ બેલટનું સંચાલન કરવા માટે સ્ક્રુટીનાઇઝર તરીકે નિમણું ક કરવામા આવી છે. (પ) ઇલેક્ટ્રોનિક માધ્યમોથી વોટીંગને સબંધિત કોઇપણ પુછપરછ/ફરિયાદ માટે સભ્યો આરટીએ એટલે કે લિંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડનો <u>ahmedabad@linkintime.co.in,</u> સ્ક્રુટીનાઇઝરનો pcs.buchassociates@gmail.com અને કંપનીનો investor@arvindinfra.com પર સંપર્ક કરી શકે છે. (૬) પોસ્ટલ બેલટ (રીમોટ ઇ-વોટીંગ મારફત) દ્વારા વોટીંગના પરિણામો મંગળવાર, પ મે, ૨૦૨૨ ના રોજ અથવા તે પહેલા જારી રવામાં આવશે. જારી કરેલ પરિણામો અને સ્કુટીનાઇઝરનો અહેવાલ કંપનીની રજીસ્ટર્ડ ઓફીસે અને કંપનીની વેબસાઇટ પર અને એનએસડીએલની વેબસાઇટ <u>www.evoting.nsdl.com</u> પર પણ ઉપલબ્ધ રહેશે. આ સિવાય સ્ટોક એક્સચેન્જ જેમાં કંપનીના શેરો લીસ્ટેડ છે તેને પણ જાણ કરવામાં આવશે.

અરવિંદ સ્માર્ટસ્પેસીસ લીમીટેડ વતી સહી/-



## CHEMPLAST SANMAR LIMITED

Regd: Office: 9, Cathedral Road, Chennai 600 086 CIN: L24230TN1985PLC011637 Phone: 044-28128500

Website: www.chemplastsanmar.com: Email: grd@sanmargroup.com

## **PUBLIC NOTICE – 38th ANNUAL GENERAL MEETING**

The 38th Annual General Meeting ("AGM") of Chemplast Sanmar Limited (CSL) will be held at 3.00 PM on Friday, the 24th June 2022 through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") facility in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the Rules made there under, read with circulars issued by Ministry of Corporate Affairs (MCA) and Securities and Exchange Board of India (SEBI). The VC / OAVM facility will be provided by KFin Technologies Limited to transact the businesses as set out in the Notice convening the AGM.

The e-copy of the Notice of the AGM along with the Annual Report for the Financial Year 2021-22 of the Company will be available on the website of the Company at www.chemplastsanmar.com, Websites of the Stock Exchanges i.e., BSE Limited & National Stock Exchange of India Limited, at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of the Company's Registrar and Share Transfer Agent, M/s. KFin Technologies Limited at <a href="https://evoting.kfintech.com/public/downloads.aspx">https://evoting.kfintech.com/public/downloads.aspx</a> (KFin).

Members can attend and participate in the Annual General Meeting through the VC/OAVM facility ONLY, the details of which will be provided by the Company in the Notice of the AGM. Members attending the Meeting through VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

The Notice of the Annual General Meeting along with the Annual Report has been sent only through electronic mode to those Members whose e-mail addresses are registered with the RTA / Depositories. Members who have not yet registered their email addresses are requested to update their e-mail id with their respective DP's to receive the login id and password for remote e-Voting /e-Voting at the AGM. The Company will not despatch physical copy of Notice of the AGM and the Annual Report to the Members in view of its green initiatives and the MCA Circulars. However the same shall be made available upon receipt of request from the Member(s), for the same in writing to the Company email id: (grd@sanmargroup.com) or the Registrar of Share Transfer Agent, KFin Technologies Limited email id: (einward.ris@kfintech.com).

In terms of Section 108 of the Companies Act 2013, applicable Rules thereon and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing the remote e-voting facility ("remote e-voting") of KFin Technologies Limited to all its Members to cast their votes on all Resolutions set out in the Notice convening the AGM of the Company. The remote e-voting will commence on 21st June 2022 from 9.00 AM (IST) and will end on 23rd June 2022 at 5.00 PM (IST). Additionally, the Company will also provide the facility of e-voting during the AGM. The voting rights of the members shall be in proportion to their shareholding in the company as on the cut-off date for e-voting i.e. 17th June, 2022. Detailed procedure for remote e-voting and e-voting has been provided in the Notice of the AGM. Dr. B Ravi , Managing Partner, M/s. B Ravi & Associates, Company Secretaries (Firm Registration No. P2016TN052400) will be the scrutinizer of the entire voting process.

Place: Chennai Date: 1st June 2022

M Raman Company Secretary & Compliance Officer Memb.No. ACS-6248

For Chemplast Sanmar Limited

સ્થળ: અમદાવાદ તારીખ: ૧ જુન, ૨૦૨૨

પ્રકાશ મકવાણા કંપની સચિવ